

## વस्तुઓ અને સેવાઓ કર : પરિચય (Introduction To Goods and Services Tax)

- |                                                  |                                            |
|--------------------------------------------------|--------------------------------------------|
| 1. પ્રસ્તાવના                                    | 4. વસેક(GST)ના લાભો                        |
| 2. વસેક(GST)નો અર્થ અને વિશિષ્ટ લક્ષણો           | 5. વસ્તુઓ અને સેવાઓ કરના દર                |
| 3. વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ (Supply) | 6. વસેક અંગેના પારિભાષિક શબ્દો – સ્વાધ્યાય |

### વિશેષ નોંધ

વસ્તુઓ અને સેવાઓ કર (વસેક)નો દેશમાં તા. 1-7-2017થી અમલ કરવામાં આવેલ છે. આ કાયદેસરની જરૂરિયાત હોવાથી તે અંગેની પ્રારંભિક સૈદ્ધાંતિક અને વ્યાવહારિક સમજૂતી આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને નામાનાં મૂળતત્ત્વો, વિષય અંગેની મૂળજ્ઞત્વ બાબતો સહેલાઈથી સમજ શકાય તે માટે વસેક સિવાયનાં વ્યાવહારિક ઉદ્ઘારણો અને પ્રશ્નો સ્વાધ્યાયમાં આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખીને ફક્ત આમનોંધ અને પેટાનોંધનાં પ્રકરણમાં વસેક (GST) સહિતની સૈદ્ધાંતિક અને વ્યાવહારિક સમજૂતી આપવામાં આવેલ છે. તેના પર શિક્ષણ દરમિયાન વિશેષ ભાર આપીને શૈક્ષણિક કાર્ય કરવા સૂચન છે.

ધોરણ 11 બાદ આગળના અભ્યાસ માટે વસેક અંગેની જાણકારી મહત્વની છે. તેથી આ બાબત અંગે વિશેષ કાળજી રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા સૂચન છે.

### 1. પ્રસ્તાવના (Introduction)

દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેરાઓ ઉધરાવવામાં આવે છે. આ વેરાઓને મુખ્યત્વે બે ભાગોમાં વહેંચવામાં આવે છે : (1) પ્રત્યક્ષ વેરા (2) પરોક્ષ વેરા.

પરોક્ષ વેરાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ઉધરાવવામાં આવે છે. ભારતના સંદર્ભમાં પરોક્ષ વેરાઓ વિવિધ સ્વરૂપે વસ્તુઓ કરવામાં આવતા હતા. પરોક્ષ વેરાઓની વિવિધતા અને તેમની કાયદેસરની જોગવાઈઓની વિવિધતાઓના કારણે તેમના સંચાલનમાં સરકાર, વેરા અધિકારીઓ અને કર ચૂકવનારાઓ માટે ઘણી સમસ્યાઓ ઉદ્ભવતી હતી. આ સમસ્યાઓનાં નિવારણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં વિવિધ પરોક્ષ વેરાઓનાં સ્થાને ‘એક દેશ એક કર’નાં સૂત્ર સાથે વસ્તુઓ અને સેવાઓ કર [વસેક (GST)] સરકાર દ્વારા 1લી જુલાઈ, 2017થી દાખલ કરવામાં આવ્યો. વસેકને નીચે પ્રમાણે સમજાવી શકાય :

કેન્દ્ર સરકારના	+	રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત	= વસેક (GST)
પરોક્ષ કરો		પ્રદેશના પરોક્ષ કરો	
– કેન્દ્રીય વેચાણવેરો		– મૂલ્યવૃદ્ધિ વેરો	
– કેન્દ્રીય આબકારી જકાત		– ખરીદ વેરો	
– વધારાની કસ્ટમ ડ્યૂટી		– વેચાણવેરો	
– સેવા કર		– મનોરંજન વેરો	

જૂના કર રદ થયા.

નવો કર તા. 1-7-2017થી અસ્તિત્વમાં આવ્યો.

કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં વસ્તુઓ અને સેવાઓના કરનાં સંદર્ભે વ્યવહારોમાં સામ્યતા અને ઉદ્દેશલક્ષી અમલીકરણ માટે પાંચ વસેક વેરા કાયદાઓ બનાવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે :

(1) કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો (The CGST Act) : આ કાયદામાં કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓની પૂર્તિનાં વ્યવહારો પર કરની જોગવાઈનો સમાવેશ કરવામાં આવેલ છે.

(2) રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો (The SGST Act) : આ કાયદામાં જે-તે રાજ્યનાં વસ્તુઓ અને સેવાઓની પૂર્તિનાં વ્યવહારો પર કરની જોગવાઈનો સમાવેશ થાય છે.

(3) કેન્દ્રશાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓ કર કાયદો (The UTGST Act) : આ કાયદામાં જે-તે કેન્દ્રશાસિત પ્રદેશના વસ્તુઓ અને સેવાઓની પૂર્તિનાં વ્યવહારો પર કરની જોગવાઈનો સમાવેશ થાય છે.

(4) संकलित वस्तुओं अने सेवाओं कर कायदो (The IGST Act) : आ कायदामां बे राज्यो/केन्द्रशासित प्रदेश वच्चेनां (आंतरराज्य) व्यवहारो माटे वस्तुओं अने सेवाओंनी पूर्तिनां व्यवहारो पर करनी जोगवाईओनो समावेश थाय छे.

(5) वस्तुओं अने सेवाओं (राज्य वणतर) कायदो (The GST Compensation Cess Act) : आ कायदा हेठल वसेकना अमलीकरणानां कारणे जे राज्योने वेराकीय आवकमां घटाए थरो तेमने ते घटाए भरपाई करी आपवाना अनुसंधाने छे.

(आ पांच कायदा विधार्थीनी जाणकारी माटे छे – परीक्षा माटे अपेक्षित नथी.)

## 2. वसेकनो अर्थ अने विशिष्ट लक्षणो (Meaning and Special Features of GST)

**अर्थ :** ● केन्द्र सरकार अने राज्य सरकारोना विविध परोक्ष करवेरा २८ करी वस्तुओं अने सेवाओने एक ज कर हेठल आवरी लेवामां आव्या छे. तेने वस्तुओं अने सेवाओं कर (वसेक - GST) तरीके ओणभवामां आवे छे.

● वस्तुओं के सेवाओनी पूर्ति (Supply) पर लाइवामां आवतो कर एटेवे वस्तुओं अने सेवाओं कर. जेने टूकमां ज्ञेसटी (GST) तरीके ओणभवामां आवे छे. वसेकनां विशिष्ट लक्षणो नीचे मुजब छे :

(1) एक ज कर : वस्तुओं अने सेवाओने एक ज कर हेठल आवरी लेवामां आव्या छे.

(2) पूर्ति पर करनी वसूलात : वस्तुओनां उत्पादन अथवा वस्तुओनां वेचाण अथवा सेवाओ पूरी पाइवाना स्थाने वस्तुओं अने सेवाओनी पूर्ति (Supply) पर कर वसूल करवामां आवे छे.

(3) वसेक काउन्सिल : वसेकनी तमाम कामगीरी वसेक काउन्सिल (GST Council) हेठल थाय छे. GST काउन्सीलमां दरेक राज्य प्रतिनिधित्व धरावे छे अने तेना अध्यक्ष तरीके केन्द्रना नाणामंत्री कामगीरी बजावे छे.

(4) वसेकना दर : वसेकना दरनी वसेक काउन्सिल द्वारा भलामाण करवामां आवे छे.

(5) आयात अने वसेक : वस्तुओं अने सेवाओनी आयातने आंतरराज्य पूर्ति तरीके ध्यानमां लेवाय छे.

(6) वसेक परत जमा (Input Tax Credit) : खरीदी वजते चूकवेल वसेक वेचाण करती वजते चूकववापात्र वसेकमांथी बाद भगे छे.

(7) कर-वहेंचणी : केन्द्र अने राज्यो वच्चे वसेकनी वहेंचणी अंगेनी योग्य व्यवस्था उल्ली करवामां आवेल छे.

(8) कर-निर्धारण : वसेकना दर वस्तु अने सेवानी जरियातने ध्यानमां राखीने नक्की करवामां आवेल छे.

(9) पूर्व निर्धारित करनुं माणभुं : वसेकना वस्तुओं माटे अने सेवाओ पर लागु पडता दरनुं पूर्व निर्धारित माणभुं आपवामां आवेल छे.

(10) पांच वसेक कायदाओ : वसेकना अनुसंधाने कुल पांच कायदाओ पसार करवामां आवेल छे.


(11) समानता : समग्र देशमां वसेक अंगे कायदाओ, नियमो, प्रक्रियाओ अने वेराना दरो समान राखवामां आवेल छे.

नोंध : वस्तुओं अने सेवाओना करने संक्षिप्तमां वसेक तरीके दर्शावेल छे.

## 3. वस्तुओं अथवा सेवाओं अथवा बंनेनी पूर्ति (Supply of Goods or Services or Both)

वस्तुओं अथवा सेवाओं अथवा बंनेनां खरीद / वेचाणानां स्थाने पूर्ति (Supply) परिभाषानो उपयोग करवामां आवे छे. वस्तुओं अथवा सेवाओं अथवा बंने (i) राज्य / केन्द्रशासित प्रदेश अंदर अने (ii) राज्य / केन्द्रशासित प्रदेश बहार पूरी पाइवामां आवे छे. आ बाबतने नीयेना कोष्टक द्वारा समज्ञाए :

वस्तुओं अथवा सेवाओं अथवा बंनेनी पूर्ति



(अ) राज्य/केन्द्रशासित प्रदेशनी अंदर पूर्ति : आ प्रकारनी पूर्तिमां वस्तुओं अथवा सेवाओं अथवा बंने जे-ते राज्य अथवा जे-ते केन्द्रशासित प्रदेशमां पूरी पाइवामां आवे छे.

आ संज्ञेगोमां बे प्रकारना करो वसूल करवामां आवे छे. जे राज्य होय, तो (i) केन्द्रीय वस्तुओं अने सेवानो कर. टूकमां CGST (केन्द्रीय वसेक) अने (ii) राज्य वस्तुओं अने सेवानो कर. टूकमां SGST (राज्य वसेक) लागु पडे छे.

તેવી જ રીતે કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રીય વસેક - CGST અને કેન્દ્રશાસિત પ્રદેશ વસેક - UTGST લાગુ પડે છે.

દા.ત., અમદાવાદના વેપારી દ્વારા ₹ 10,000ના માલનું રાજકોટના વેપારીને વેચાણ કરવામાં આવ્યું. વસેકનો કુલ દર 12 % છે.

અહીં ₹ 10,000ના 12 % લેખે ₹ 1200 વસેક (GST) તરીકે વસૂલ કરવામાં આવે છે. આ 12 % પૈકી (i) ₹ 10,000નાં 6 % લેખે ₹ 600 કેન્દ્રીય વસેક જેને CGST કહેવાય છે તે કેન્દ્ર સરકાર લેશે.

(ii) ₹ 10,000નાં 6 % લેખે ₹ 600 રાજ્ય વસેક જેને SGST કહેવાય છે, તે જે-તે રાજ્ય સરકાર લેશે.

ધારો કે આ વ્યવહાર ચંદ્લીગઢ કેન્દ્રશાસિત પ્રદેશમાં થતો હોય, તો 6 % લેખે ₹ 600 CGST વસૂલ કરવામાં આવશે અને 6 % લેખે ₹ 600 કેન્દ્રશાસિત પ્રદેશ વસેક (UTGST) વસૂલ કરવામાં આવશે.

જ્યારે એક જ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની અંદર વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને પૂરી પાડવામાં આવેલ હોય ત્યારે વસેક (GST)ની રકમ કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક / કેન્દ્રશાસિત પ્રદેશ વસેક તરીકે કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચે સરખે હિસ્સે વહેંચવી આપવામાં આવે છે.

**(બ) રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની બહાર પૂર્તિ :** આ પ્રકારની પૂર્તિમાં વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ પોતાના રાજ્ય/કેન્દ્રશાસિત બહાર પૂરી પાડવામાં આવે છે.

આ સંજોગોમાં એક જ પ્રકારનો કર વસૂલ કરવામાં આવે છે. જેને સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર તરીકે ટૂંકમાં IGST (સંકલિત વસેક) તરીકે ઓળખવામાં આવે છે.

દા.ત., અમદાવાદમાં વેપારી દ્વારા ₹ 10,000 નો માલ જ્યપુરનાં વેપારીને 12 % વસેકથી વેચવામાં આવ્યો.

અહીં ₹ 10,000 પર 12 % લેખે ₹ 1200 સંકલિત વસેક (IGST) કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવામાં આવશે.

ટૂંકમાં જ્યારે પોતાના રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં જ વ્યવહાર થાય તો તેને અંતરરાજ્ય (Intra state) વ્યવહાર કહેવાય છે. પોતાના રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સિવાયના રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચેનો વ્યવહાર આંતરરાજ્ય (Inter state) વ્યવહાર કહેવાય છે.

વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ (ખરીદી અને વેચાણ) માટે લાગુ પડતા વસેકની વિગતો :

ક્રમ	વ્યવહાર	જે-તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની અંદર (અંતરરાજ્ય પૂર્તિ વસેક)	જે-તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ બહાર (આંતરરાજ્ય પૂર્તિ વસેક)
1.	વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની ખરીદી (પૂર્તિ)	(i) આવક પૂર્તિ કેન્દ્રીય વસેક (Input CGST) (ii) આવક પૂર્તિ રાજ્ય વસેક / કેન્દ્રશાસિત પ્રદેશના વસેક (Input SGST / UTGST)	આવક પૂર્તિ સંકલિત વસેક (Input IGST)
2.	વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેનું વેચાણ (પૂર્તિ)	(i) જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક (Output CGST) (ii) જાવક પૂર્તિ રાજ્ય વસેક / કેન્દ્રશાસિત પ્રદેશના વસેક (Output SGST / UTGST)	જાવક પૂર્તિ સંકલિત વસેક (Output IGST)

**નોંધ :** હવે પછીનાં તમામ પ્રકરણોમાં વસેકના સંદર્ભ ઉપર દર્શાવ્યા પ્રમાણેના શબ્દ-પ્રયોગ કરવામાં આવેલા છે. વિદ્યાર્થીઓએ આ અંગે કાળજીપૂર્વક અભ્યાસ કરવો. (i) રાજ્યની અંદર થતાં પૂર્તિ વ્યવહારો માટે CGST સાથે SGST લાગુ પડે છે અને કેન્દ્રશાસિત પ્રદેશની અંદર થતાં પૂર્તિ વ્યવહારો માટે CGST સાથે UTGST લાગુ પડે છે. (ii) જે-તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનાં અન્ય રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચેનાં પૂર્તિ વ્યવહારો માટે IGST લાગુ પડે છે.

#### 4. વસેકના લાભો (Benefits of GST)

- (1) એક જ કર : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરોનાં સ્થાને એક જ કરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
- (2) સરળ કર-વ્યવસ્થા : વિવિધ પ્રકારના પરોક્ષ વેરાઓ રદ થવાથી પરોક્ષ કર વ્યવસ્થા સરળ બની છે.

- (3) બેવડા કર દૂર : વસેકના અમલીકરણ પહેલાં કર ભરનારાઓ માટે બેવડા કર ભરવાની જવાબદારી ઊભી થતી હતી તે હવે દૂર થઈ ગઈ છે.
- (4) ભાવ ઘટાડાનો લાભ : ઉપભોક્તા માટે વસ્તુઓ અને સેવાઓના ભાવમાં ઘટાડો થવા પામે છે.
- (5) સમાન વેરો : દેશ વ્યાપી સમાન વેરાઓની વ્યવસ્થા ઊભી થવા પામી છે.
- (6) કરચોરીમાં ઘટાડો : કરચોરીનાં દૂધજામાં ઘટાડો અને કર વ્યવસ્થામાં પારદર્શકતા પ્રસ્થાપિત થાય છે.
- (7) વસેક પરત જમા : ખરીદી પર ચૂકવવામાં આવેલ વસેક – વેચાણ પર ચૂકવવાપાત્ર વસેકમાંથી બાદ મળે છે. તેથી કર ભરનારે ચોખ્યી રકમ ભરવાની હોય છે.
- (8) અર્થતંત્રમાં ઉપયોગી : અર્થ વ્યવસ્થામાં મજબૂતાઈ પ્રાપ્ત થાય છે.
- (9) સમાન પ્રાદેશિક વિકાસ : રાજ્યોનો સમાન વિકાસ થવા પામશે – પ્રાદેશિક અસમાનતા ઘટવા પામશે.
- (10) વહીવટી કામગીરીમાં ઘટાડો : કર ભરનારની હિસાબી કામગીરીમાં ઘટાડો થવા પામ્યાં છે.
- (11) સરકારી કામગીરીમાં ઘટાડો : કરવેરા ઓફિસોની કામગીરીમાં ઘટાડો થવા પામ્યો છે.

## 5. વસ્તુઓ અને સેવાઓ કરના દર (Rate of GST)

વસ્તુઓ અને સેવાઓને એક જ પરોક્ષ કર માળખા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેને વસ્તુઓ અને સેવાઓ કર (વસેક) કહેવામાં આવે છે. આ કર કાયદા હેઠળ વસ્તુઓ અને સેવાઓની જરૂરિયાત ધ્યાનમાં રાખીને જુદા-જુદા કરનાં દરો નક્કી કરવામાં આવ્યા છે. મૂળભૂત જરૂરિયાતોથી મોજશોખની સગવડો સુધીની વસ્તુઓ અને સેવાઓ અંગે વિભિન્ન દરો નક્કી કરવામાં આવેલ છે. મૂળભૂત જરૂરિયાતો વસ્તુના સ્વરૂપે હોય છે જેમાં 0 % દરથી 28 % સુધીના દરનો સમાવેશ થાય છે.

રાજ્ય બહાર અને રાજ્યમાં વસ્તુઓ પૂર્તિ અંગેના વસેક દરો. [Notification no. 1/2017 Central Tax (Rate) and 1/2017 Integrated Tax (Rate)]

પરિશિષ્ટ અને વસેક દર	આંતરરાજ્ય (બે રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે પૂર્તિ) (સંકલિત વસેક – IGST)	અંતરરાજ્ય (જે-તે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં જ આંતરિક પૂર્તિ)	
		(કેન્દ્રીય વસેક – CGST)	(રાજ્ય વસેક – SGST)
પરિશિષ્ટ 1	5 %	2.5 %	2.5 %
પરિશિષ્ટ 2	12 %	6 %	6 %
પરિશિષ્ટ 3	18 %	9 %	9 %
પરિશિષ્ટ 4	28 %	14 %	14 %
પરિશિષ્ટ 5	3 %	1.5 %	1.5 %
પરિશિષ્ટ 6	0.25 %	0.125 %	0.125 %

નોંધ : (1) ખાસ વસ્તુઓનાં સંદર્ભમાં IGST ના દર 0.25 % અને 3 % રાખવામાં આવેલ છે.

(2) સેવાઓ માટે પણ મુખ્યત્વે ચાર સ્લેબ 5 %, 12 %, 18 % અને 28 % સંદર્ભમાં લાગુ પડે છે.

(3) GSTનાં દરોમાં સમયાંતરે ફેરફાર થવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી પુસ્તક નાં લખાણ સમયે પ્રવર્તમાન દરો ધ્યાનમાં લેવામાં આવેલ છે.

## 6. વસેક (GST) અંગેના પારિભાષિક શબ્દો

ક્રમ	ગુજરાતી	અંગ્રેજી
1	પૂર્તિ (ખરીદ-વેચાણ)	Supply (Purchase - Sales)
2	આવકપૂર્તિ કેન્દ્રીય વસેક	Input Central GST (CGST)
3	આવકપૂર્તિ રાજ્ય વસેક	Input State GST (SGST)
4	આવકપૂર્તિ કેન્દ્રશાસિત પ્રદેશનાં વસેક	Input Union Territory GST (UTGST)
5	આવકપૂર્તિ સંકલિત વસેક	Input Integrated GST (IGST)
6	જાવકપૂર્તિ કેન્દ્રીય વસેક	Output Central GST (CGST)
7	જાવકપૂર્તિ રાજ્ય વસેક	Output State GST (SGST)

8	જાવકપૂર્તિ કેન્દ્રશાસિત પ્રદેશનાં વસેક	Output Union Territory GST (UTGST)
9	જાવકપૂર્તિ સંકલિત વસેક	Output Intergrated GST (IGST)
10	અંતરરાજ્ય પૂર્તિ	Intra State Supply
11	આંતરરાજ્ય પૂર્તિ	Inter State Supply

स्वाध्याय

1. નીચેના દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :



2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો :

- (1) ભારતમાં દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર દ્વારા કયા-કયા પરોક્ષ વેરાઓ વસૂલ કરવામાં આવતાં હતાં ?
  - (2) વસેક ડેટા કઈ-કઈ બાબતો કરપાત્રતા ધરાવે છે ?
  - (3) વસુઓ અને સેવાઓ અથવા બંનેનાં ખરીદ-વેચાણ અંગે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ?
  - (4) આંતરરાજ્ય પૂર્તિ-વ્યવહાર એટલે શું ?
  - (5) આંતરરાજ્ય પૂર્તિ-વ્યવહારને કયા-કયા વસેક લાગુ પડે છે ?
  - (6) આંતરરાજ્ય પૂર્તિ-વ્યવહાર એટલે શું ?
  - (7) આંતરરાજ્ય પૂર્તિ-વ્યવહારને કયા-કયા વસેક લાગુ પડે છે ?
  - (8) કયા પ્રકારના પૂર્તિ-વ્યવહારમાં વસેક કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સરખે હિસ્સે વહેંચાય છે ?
  - (9) આવકપૂર્તિ વસેક કયારે લાગુ પડે છે ?
  - (10) જાવકપૂર્તિ વસેક કયારે લાગુ પડે છે ?
  - (11) વસેક પરત જમા એટલે શું ?
  - (12) કયા પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વસેકના દર નક્કી કરવામાં આવ્યા છે ?
  - (13) વસેક દરનાં વર્તમાન સ્લેબ કયા છે ?

### 3. નીચેના પ્રશ્નોના ટંકમાં જવાબ આપો :

- (1) વસેકનાં કોઈ પણ બે વિશિષ્ટ લક્ષણો સમજાવો.  
 (2) વસેકના કોઈ પણ બે લાભો સમજાવો.

